

કોર્ટ ઓફ કમિશનર (વિકલાંગ વ્યક્તિઓ માટેના)

ગુજરાત રાજ્ય

(Deemed Civil Court) વિકલાંગ ધારો (સમાનતકો, અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી) ૧૯૯૫

બ્લોક નં. ૧૬ ભોયતળીયે, ડૉ. જીવરાજ મહેતા ભવન, સેક્ટર-૧૦, ગાંધીનગર-૩૮૨૧૦

કેસ નં. ૫૨૩ / ૨૦૧૫

ક્રમાંક કમિ/ અપગ/૨૦૧૫-૧૬/

તા. ૨૬ / ૧૧ / ૨૦૧૫

અરજદાર:-

ગોંડલીયા પ્રેરક જયેશભાઈ

ક્વાર્ટર નં.એચ-૨, સરકારી વસાહત,

જુના થાણા, નવસારી - ૩૮૬૪૪૫.

વિ રૂ ધ્ય

સામાવાણા:-

- (૧) બાગાયત અધિકારી, નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જુના જીલ્લા તિજોરી કચેરી પાસે, ટાઉન પોલીસ સ્ટેશન પાછળ, મોટા બજાર, નવસારી-૩૮૬૪૪૫.
- (૨) રજિસ્ટ્રારશ્રી, કૃષિ યુનિવર્સિટી, નવસારી.

ગોંડલીયા પ્રેરક જયેશ, ધ્વારા પોતે અસ્થી વિષયક વિકલાંગતા ધરાવતા ઇસમ હોઈ અને બી.એસ.સી. હોર્ટીકલ્ચરલ સ્નાતકના અભ્યાસક્રમમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે. તેઓની નવસારી કૃષિ યુનિવર્સિટી ધ્વારા અનુસ્નાતકના અભ્યાસનું રીરજીસ્ટ્રેશનની અરજી યુનિવર્સિટી ધ્વારા સ્વીકારવામાં આવતી ન હોઈ આ કોર્ટમાં તા.૧૩/૧૦/૨૦૧૫ થી દાવો દાખલ કરી દાદ માંગેલ, જે અન્વયે તા.૨૯/૧૦/૨૦૧૫ ના રોજ મુદત રાખવામાં આવેલ. મુદતે શ્રી પ્રેરક ગોંડલીયા વતી તેમના પિતાશ્રી જયેશભાઈ ગોંડલીયા હાજર રહેલા છે, પરંતુ કૃષિ યુનિવર્સિટી, નવસારી તરફથી કોઈ હાજર રહેલ ન હતા. પુનઃ આ કેસની મુદત તા.૨૦/૧૧/૨૦૧૫ ના રોજ રાખવામાં આવેલ. પુનઃ આ મુદતે પણ રજીસ્ટ્રારશ્રી, કૃષિ યુનિવર્સિટી તરફથી કોઈ હાજર રહેલ નથી. શ્રી પ્રેરક ગોંડલીયા વતી તેમના પિતાશ્રી જયેશભાઈ ગોંડલીયા હાજર રહેલા છે અને તેઓએ તેમના પુત્રને રજીસ્ટ્રારશ્રી, કૃષિ યુનિવર્સિટી ધ્વારા

અનુસ્નાતક અભ્યાસનું રીરજીસ્ટ્રેશન કરાવેલ હોઇ તેમને કોઇ પ્રકારનો અન્યાય થયેલ ન હોઇ દાવો રદ કરવા અને તેઓએ મુકેલ દાવો પાછો ખેંચવા રજુઆત કરેલ છે.

કેસની સમગ્ર વિગતો ધ્યાને લઇ હું નીચે મુજબ હુકમ કરું છું.

હુકમ

શ્રી ગોંડલીયા પ્રેરક જયેશભાઇ ધ્વારા દાખલ કરવામાં આવેલ કેસ નંબર- ૫૨૩/૨૦૧૫ પાછો ખેંચવાની આથી અનુમતિ આપી કેસ રદ કરું છું.

( સંજય નંદન )  
કમિશનર ઓફ ધી કોર્ટ.

પ્રતિ ,

ગોંડલીયા પ્રેરક જયેશભાઇ, ક્વાર્ટર નં.એચ-૨, સરકારી વસાહત, જુના થાણા, નવસારી - ૩૯૬૪૪૫.

નકલ રવાના - (૧) બાગાયત અધિકારી, નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જુના જીલ્લા તિજોરી

કચેરી પાસે, ટાઉન પોલીસ સ્ટેશન પાછળ, મોટા બજાર, નવસારી-૩૯૬૪૪૫.

(૨) રજિસ્ટ્રારશ્રી, કૃષિ યુનિવર્સિટી, નવસારી.